

B.A. Semester - 5 (Remedial) (CBCS) Examination
February/March. -2020

ECONOMICS : P14 INTERNATIONAL ECONOMICS - 1(CORE/EC-14)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	આંતર રાષ્ટ્રીય વ્યાપારની સમજૂતી માટે જૂદા સિધ્ધાંતની જરૂર છે? શા માટે?	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૧	આંતર રાષ્ટ્રીય વ્યાપારનો તુલનાત્મક ખર્ચનો સિધ્ધાંત સમજાવો.	
પ્રશ્ન.૨	મુક્ત વ્યાપારના લાભા-લાભ ચર્ચો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૨	વિનિમય દર નિર્ધારણનો માંગ અને પુરવઠાનો સિધ્ધાંત સમજાવો.	
પ્રશ્ન.૩	સંરક્ષણનો અર્થ આપી બાળ ઉદ્યોગના સંરક્ષણ અને રોજગારી સર્જનની દલીલો તપાસો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૩	પરિવર્તન શીલ વિનિમયદર એટલે શું? તેની તરફેણની દલીલો તપાસો.	
પ્રશ્ન.૪	લેણદેણની તૂલાનો અર્થ સમજાવી, લેણદેણની તૂલામાં ખાધ માટેના કારણો ચર્ચો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૪	વિનિમય દર નિર્ધારણનો સમખરીદશક્તિનો સિધ્ધાંત સમજાવો.	
પ્રશ્ન.૫	ટૂંકનોંધ લખો. (કોઈપણ બે)	(૧૪)
	(1) લેણદેણની તૂલાની અસમતુલા નિવારવાના ઉપાયો.	
	(2) આયાત જકાત અને આયાત ક્વોટા.	
	(3) સ્થિર વિનિમયદરની તરફેણની દલીલો.	
	(4) પારસ્પારિક માંગનો સિધ્ધાંત.	

ENGLISH VERSION

Q.1	Is there a need for a separate theory for explaining international trade? Why?	(14)
	OR	
Q.1	Explain the comparative cost theory of international trade.	
Q.2	Discuss the advantages and disadvantages of free trade.	(14)
	OR	
Q.2	Explain the demand and supply theory of exchange rate determination.	
Q.3	Give the meaning of protection and examine the arguments to favouring the protection for infant industry and creating employment.	(14)
	OR	
Q.3	What is meant by the flexible exchange rate? Examine the argument in its favour.	
Q.4	Explain the meaning of balance of payment and discuss the reasons for deficit in balance of payment.	(14)
	OR	
Q.4	Explain the purchasing power parity theory regarding exchange rate determination.	
Q.5	Write short note. (any two)	(14)
	(1) The remedies to eliminate the deficit in balance of payment.	
	(2) The tariff and quota.	
	(3) Arguments in favour of the fixed exchange rate.	
	(4) The theory of reciprocal demand.	
